

ત્વરિત જાહેરાત માટે

જૂન મહિનાને સિટી ઓફ બ્રેમ્પટન હેરિટેજ માસ તરીકે વર્ચુઅલ માધ્યમથી ઉજવશે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (01 જૂન 2021) – સિટી ઓફ બ્રેમ્પટન પોતાના બહુસાંસ્કૃતિક મોઝેકને જૂન મહિનામાં વર્ચુઅલ માધ્યમથી બિરદાવશે, જે રાષ્ટ્રીય આદિજાતિ સમાજ માસ તરીકે યોજવા ઉપરાંત તેમના ઇટાલિયન, પોર્ચ્યુગીઝ અને ફિલિપિનો સમુદાયોને બિરદાવશે.

ઇટાલિયન હેરિટેજ માસ

ઇટાલિયન હેરિટેજ માસ શરૂ થશે બુધવાર જૂન 2ના રોજ જે ઇટાલિયન રાષ્ટ્રીય દિન છે જેમાં વર્ચુઅલ માધ્યમથી ધ્વજરોહણ વિધિ થશે જેમાં મેયર પેટ્રિક બ્રાઉન, પેટ ફોર્ટિની, રિજનલ કાઉન્સિલર, વોર્ડ 7 અને 8, અને માર્કલ પાલેશી; રિજનલ કાઉન્સિલર, વોર્ડ 2 અને 6 દ્વારા ઉદ્બોધન કરવામાં આવશે. આ ઉજવણી અને ઇતિહાસનો પરિચય આપવામાં આવશે, જે પરંપરાગત રેસિપિના ટુટોરિયલ (મિષ્ટાન અને ફરસાણ) હશે તેમજ વિતેલ ઇવેન્ટોની તસ્વીરો સાથેની ફોટો ગેલેરી હશે.

ઇટલી બ્રેમ્પટન ખાતે રહેતા ટોચની 10 વંશીય ઉત્પત્તિઓ પૈકી એક છે જ્યાં શહેરમાં 25,200 રહેવાસીઓ રહે છે જેનો આધાર સૌથી તાજેતરની વસ્તી ગણતરીમાંથી લીધેલ છે.

ઉજવણીમાં જોડાવા માટે, અહીં મુલાકાત લો www.brampton.ca/filipinoheritagemonth

પોર્ચ્યુગીઝ હેરિટેજ માસ

પોર્ચ્યુગીઝ હેરિટેજ માસ શરૂ થશે ગુરૂવાર જૂન 10ના રોજ જે 'પોર્ચ્યુગલ દિન' છે જેમાં વર્ચુઅલ માધ્યમથી ધ્વજરોહણ વિધિ થશે જેમાં મેયર પેટ્રિક બ્રાઉન, માર્ટિન મેડિરોસ, રિજનલ કાઉન્સિલર, વોર્ડ 3 અને 4, અને પૉલ વિસેન્ટ; રિજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5 દ્વારા ઉદ્બોધન કરવામાં આવશે. આ ઉજવણી અને ઇતિહાસનો પરિચય આપવામાં આવશે, જે પરંપરાગત રેસિપિના ટુટોરિયલ (મિષ્ટાન અને ફરસાણ) હશે તેમજ વિતેલ ઇવેન્ટોની તસ્વીરો સાથેની ફોટો ગેલેરી હશે.

પોર્ચ્યુગલ બ્રેમ્પટન ખાતે રહેતા ટોચની 10 વંશીય ઉત્પત્તિઓ પૈકી એક છે જ્યાં શહેરમાં 24,500 રહેવાસીઓ રહે છે જેનો આધાર સૌથી તાજેતરની વસ્તી ગણતરીમાંથી લીધેલ છે.

ઉજવણીમાં જોડાવા માટે, અહીં મુલાકાત લો www.brampton.ca/filipinoheritagemonth

ફિલિપીનો હેરિટેજ માસ

ફિલિપિનો હેરિટેજ માસ શરૂ થશે શનિવાર, જૂન 12ના રોજ જે તે તારીખની સ્મૃતિ કરાવશે જ્યારે 1898ની સાલમાં સહુ પ્રથમ વખત ફિલિપાઈન્સનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. વર્ચુઅલ ધ્વજરોહણ વિધિ હાથ ધરાશે જેમાં મેયર પેટ્રિક બ્રાઉન અને રોવેના સાન્તોસ રીજનલ

કાઉન્સિલર વોર્ડ 1 અને 5 વક્તવ્ય આપશે. એમાં માણી શકાશે ક્વિલિપાઈન્સના રાષ્ટ્ર ગીતનું પ્રિ રેકોર્ડેડ ગાન અને એક ઉદ્યાનના પુનઃનામકરણનો વિડિયો જે બ્રમ્પટનના ઉત્તર-પૂર્વમાં સ્થિત છે જે ક્વિલિપાઈન્સના સૌથી મહાન ગણાતા સપૂત ડો. જોલે પ્રોતાસિયો રિઝાલને સમર્પિત છે. આ ઉજવણી અને ઈતિહાસનો પરિચય આપવામાં આવશે, બે પરંપરાગત રેસિપિના ટુટોરિયલ (મિથાન અને ફરસાણ) હશે તેમજ વિતેલ ઈવેન્ટોની તસ્વીરો સાથેની ફોટો ગેલેરી હશે.

ક્વિલિપાઈન્સ બ્રમ્પટન ખાતે રહેતા ટોચની 10 વંશીય ઉત્પત્તિઓ પૈકી એક છે જ્યાં શહેરમાં 20,100 રહેવાસીઓ રહે છે જેનો આધાર સૌથી તાજેતરની વસ્તી ગણતરીના ડેટામાંથી લીધેલ છે.

ઉજવણીમાં જોડાવા માટે, અહીં મુલાકાત લો www.brampton.ca/filipinoheritagemonth

રાષ્ટ્રીય આદિજાતિ ઈતિહાસ માસ

જુનમાં અમે કેનેડામાં રાષ્ટ્રીય આદિજાતિ ઈતિહાસ માસને ફર્સ્ટ નેશન્સ, ઈનુઈટ અને મેટિસ સમુદાયોના વૈવિધ્ય અને વિશિષ્ટ યોગદાનને વધાવી લેવામાં આવશે.

અમારું કાર્ય મિસિસાગાના કેડિટ ફર્સ્ટ નેશનની ટ્રીટી ટેરિટરીમાં હાથ ધરાશે અને તેની પહેલા હાઉડેનોસૌની (Haudenosaunee), હુરોન (Huron) અને ઉએનડાટ (Wendat)ની પરંપરાગત ભૂમિ પર થશે તેનો સિટી ઓફ બ્રમ્પટન આદર કરે છે અને સ્વીકાર કરે છે. અમે તેનો પણ સ્વીકાર કરીએ છીએ કે અનેક ફર્સ્ટ નેશન, મેટિસ, ઈનુઈટ અને અન્ય વૈશ્વિક આદિજાતિના લોકો હવે બ્રમ્પટનને પોતાનું વતન માને છે. અમને આ ભૂમિ પર રહેવા, કાર્ય કરવા અને તેને માણવાનું ગૌરવ પ્રાપ્ત છે.

આ મહિનો એક એવી તક છે જ્યારે આપણે આદિજાતિના લોકો તેમજ તેઓના અસાધારણ યોગદાનના (ભૂતકાલીન અને વર્તમાન) વારસા, વૈવિધ્યસભર સંસ્કૃતિઓ, વિશિષ્ટ ભાષાઓ અને આધ્યાત્મિક માન્યતાઓને ધ્યાન પર લઈ શકીશું અને તેના વિશેની જાણકારી મેળવી શકીશું જે હજુ પણ આપણા સમાજને સમૃદ્ધ કરી રહ્યા છે.

પ્રણાલીગત અન્યાય દ્વારા જેઓ પર અતિ દુઃખદ પ્રભાવ પડ્યા હોય તેમનું અને જે 215 બાળકોએ જીવ ગુમાવ્યા હતાં જેમના અવશેષો આ વર્ષે કામલૂપ ખાતેની રેસિડેન્સિયલ સ્કૂલની સાઈટ પર મળી આવ્યા તેનો શોક મનાવીએ છીએ અને તેમનું સ્મરણ કરીએ છીએ. અમે આદિજાતિના લોકો સાથે સુદૃઢપણે ઊભા છીએ અને સમાધાન માટેની અમારી પ્રતિબદ્ધતા દૃઢપણે ધારણ કરીએ છીએ.

સિટી ઓફ બ્રમ્પટન સાંસ્કૃતિક વિધિઓ અને ઉજવણીઓની પવિત્રતા અને મહત્વનો સ્વીકાર કરે છે. COVID-19ને કારણે આ વર્ષે ઉજવણીઓ અને ઈવેન્ટ્સ અલગ હોવા છતાં, સિટી નેશનલ ઈન્ડિજિનસ પિપલ્સ ડે (રાષ્ટ્રીય આદિજાતિ સમુદાય દિન) ઉજવવા માટે પ્રતિબદ્ધ છે જે વર્ચ્યુઅલ માધ્યમ પર આકાર લેશે સોમવાર, જુન 21ના રોજ, જેથી અમે તેઓના અનુભવોને સ્વીકારી શકીએ અને તેઓની અનુપમ જરૂરિયાતોને ધ્યાન પર લઈ શકીએ, તેઓને અમારા કાન આપી શકીએ અને તેમના અવાજને અને તેમની વાતોને વિસ્તૃત રૂપ આપી શકીએ.

નેશનલ ઈન્ડિજિનસ પિપલ્સ ડે (રાષ્ટ્રીય આદિજાતિ સમુદાય દિન) ઓનલાઇન ઉજવણીનો પ્રારંભ વર્ચુઅલ માધ્યમથી ધ્વજરોહણથી થશે અને ત્યાર બાદ ક્રાઉન લેન્ડ્સ (Crown Lands)નો ઓનલાઇન કાર્યક્રમ થશે. ચીફ આર. સ્ટેસિ લકોર્મ દ્વારા મિસિસાગાના ન્યુ ક્રેડિટની લેન્ડ એકનોલેજમેન્ટ આપવામાં આવશે; જમાણ થશે; વર્ચુઅલ સ્ટ્રોબેરી મૂન ટિચિંગ ટ્રેસી ગિલટાય સાથે થશે; અને જાબાકવે અને જોઈસ ટાબોબોડંગ જેવા વડીલો પરંપરાગત કોર્ન સૂપ ટિચિંગ આપશે. વધુ જાણકારી માટે www.brampton.ca/NIPD ની મુલાકાત લો.

જુનના ઉત્સવો પ્રોવિન્સ ઓફ ઓન્ટારિયો આરોગ્ય મંત્રાલય અને રિજન ઓફ પીલ પબ્લિક હેલ્થના COVID-19ના આદેશો અને માર્ગદર્શિકા અનુસાર આ વર્ષે તમામ વર્ચુઅલ ઇવેન્ટ્સ હશે.

સુવાક્યો

"આ જુન માસમાં, અમે આપણા જબરદસ્ત વૈવિધ્ય ધરાવતા શહેરના ગતિશીલ સમુદાયોના યોગદાનનો સ્વીકાર કરીશું તેમજ તેને વધાવીશું. અમે અનેક અલગ અલગ સાંસ્કૃતિક ઇવેન્ટ્સને સંપૂર્ણપણે સમાવેશિત ફેમવર્ક ઊભું કરવા માટે સમર્થન આપીએ છીએ જે આપણા શહેરના વૈવિધ્યને ચમકાવે છે."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"કાર્યસ્થળ તેમજ સમુદાયમાં વૈવિધ્ય અને સમાવેશિતા બ્રેમ્પટન જેવા શહેરના કદની સુધરાઈ માટે મહત્વપૂર્ણ છે. આ ઉત્સવોનું માધ્યમ નાગરિકોને બીજી સંકૃતિઓ વિશે જાણકારી મેળવવાની જબરદસ્ત તક પૂરી પાડે છે તેમજ આપણું શહેર સમાવી લે છે એવા ઘણા બધાં સમાજોને જાણવા ઓળખવાનો અવસર ઊભો કરે છે.

- હરકિરત સિંઘ, સિટી કાઉન્સિલર, વોર્ડ 9 અને 10, પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સીટી ઓફ બ્રેમ્પટન

"આ વર્ષના હેરિટેજ માસની ઉજવણીઓ દરમિયાન, અમે એક સિટી ઓફ બ્રેમ્પટનના ઉદ્યાનને ડૉ. જોહા પ્રોટાસિઓ રિઝાલને સમર્પિત કરીએ છીએ જેઓ ફિલિપાઈન્સના એક મહાન સપૂત ગણવામાં આવે છે. બ્રેમ્પટનમાં ચુંટાઈ આવેલ પ્રથમ ફિલિપિનો તરીકે મને આપણા સમાજ સાથે આ નવો ઉદ્યાન શેર કરતા બેહદ રોમાંચ અને ગૌરવની લાગણી થાય છે."

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; ઉપપ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટન

"અમને હેરિટેજ મન્થ ઉજવતા આનંદની લાગણી થાય છે અને સ્વીકાર કરીએ છીએ કે કાર્યસ્થળ પર વૈવિધ્ય અને સમાવેશિતા અમારી સંસ્થા માટે નવા દ્રષ્ટિકોણ સ્થાપે છે જે જનતાની યોગ્ય રીતે સેવા કરવા માટેની આપણા સમાજની જરૂરિયાત સમજવામાં ઉન્નતિ કરે છે."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडात्मक संवाद

सीटी ओफ़ ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca